

2/5

PLAN SHOWING PROP. RESL. BUNGLOWS OF

SUR. NO.- 23A, P. NO. - 92/L, O.P.NO. - 92/L, T.P. NO.- 61

(KHORLA-KHODIYAR, MOJE - KHODIYAR, TA.- DASKROI

DIST.-:- PATNA-2024-2025)

2/5

PLAN SHOWING PROP. RESL. BUNGLOWS OF

SUR. NO.- 23A, P. NO. - 92/L, O.P.NO. - 92/L, T.P. NO.- 61

(KHORLA-KHODIYAR, MOJE - KHODIYAR, TA.- DASKROI

DIST.-:- PATNA-2024-2025)

SCALE: 1:100 CM (UNIT)

ZONE: 1

BLOCK-A (PENA. NO. 1 TO 9)

RESIDENCE II (COVERLAY -RAH)

USE

AREA TABLE

USE	AREA	UNIT
FLOOR	753.68	SQ. FT.
GROUND	753.68	SQ. FT.
FIRST	753.68	SQ. FT.
SECOND	753.68	SQ. FT.
TOTAL	3014.72	SQ. FT.

RESIDENCE

IN SQ. MTS.

RESIDENCE	IN SQ. MTS.
F.S.I AREA	753.68
B.U.P AREA	753.68
TOTAL	1507.36

USE

AREA TABLE

USE	AREA	UNIT
FLOOR	753.68	SQ. FT.
GROUND	753.68	SQ. FT.
FIRST	753.68	SQ. FT.
SECOND	753.68	SQ. FT.
TOTAL	3014.72	SQ. FT.

RESIDENCE

IN SQ. MTS.

RESIDENCE	IN SQ. MTS.
F.S.I AREA	753.68
B.U.P AREA	753.68
TOTAL	1507.36

USE

AREA TABLE

USE	AREA	UNIT
FLOOR	753.68	SQ. FT.
GROUND	753.68	SQ. FT.
FIRST	753.68	SQ. FT.
SECOND	753.68	SQ. FT.
TOTAL	3014.72	SQ. FT.

RESIDENCE

IN SQ. MTS.

RESIDENCE	IN SQ. MTS.
F.S.I AREA	753.68
B.U.P AREA	753.68
TOTAL	1507.36

USE

AREA TABLE

USE	AREA	UNIT
FLOOR	753.68	SQ. FT.
GROUND	753.68	SQ. FT.
FIRST	753.68	SQ. FT.
SECOND	753.68	SQ. FT.
TOTAL	3014.72	SQ. FT.

RESIDENCE

IN SQ. MTS.

RESIDENCE	IN SQ. MTS.
F.S.I AREA	753.68
B.U.P AREA	753.68
TOTAL	1507.36

USE

AREA TABLE

USE	AREA	UNIT
FLOOR	753.68	SQ. FT.
GROUND	753.68	SQ. FT.
FIRST	753.68	SQ. FT.
SECOND	753.68	SQ. FT.
TOTAL	3014.72	SQ. FT.

RESIDENCE

IN SQ. MTS.

RESIDENCE	IN SQ. MTS.
F.S.I AREA	753.68
B.U.P AREA	753.68
TOTAL	1507.36

USE

AREA TABLE

USE	AREA	UNIT
FLOOR	753.68	SQ. FT.
GROUND	753.68	SQ. FT.
FIRST	753.68	SQ. FT.
SECOND	753.68	SQ. FT.
TOTAL	3014.72	SQ. FT.

RESIDENCE

IN SQ. MTS.

RESIDENCE	IN SQ. MTS.
F.S.I AREA	753.68
B.U.P AREA	753.68
TOTAL	1507.36

USE

AREA TABLE

USE	AREA	UNIT
FLOOR	753.68	SQ. FT.
GROUND	753.68	SQ. FT.
FIRST	753.68	SQ. FT.
SECOND	753.68	SQ. FT.
TOTAL	3014.72	SQ. FT.

RESIDENCE

IN SQ. MTS.

RESIDENCE	IN SQ. MTS.
F.S.I AREA	753.68
B.U.P AREA	753.68
TOTAL	1507.36

USE

AREA TABLE


USE	AREA	
-----	------	--

ખાસ શરત :- નામ સુપ્રિમ કોર્ટ SLP (Civil) નં. ૪૪૫૦-૪૪૫૧/૨૦૧૪ માં જે આખરી જજનેન્ટ આવે તે બંધનકર્તા રહેશે. તે બાબતે અરજદારશ્રીએ અપેલ બાંહેધરી પત્રકને આધીન આ વિકાસ પરવાનગી આપવામાં આવે છે.


UNIT BUILD UP AREA - TABLE									
UNIT BUILD UP AREA CALC. IN SQ.MTS		UNIT BUILD UP AREA CALC. IN SQ.FT.		UNIT BUILD UP AREA CALC. IN SQ.MTS		UNIT BUILD UP AREA CALC. IN SQ.FT.		UNIT BUILD UP AREA CALC. IN SQ.MTS	
BLOCK - A	UNIT NO.-1	BLOCK - A	UNIT NO.-1	BLOCK - A	UNIT NO.-1	BLOCK - A	UNIT NO.-1	BLOCK - A	UNIT NO.-1
NET AREA	72.00	NET AREA	72.00	NET AREA	72.00	NET AREA	72.00	NET AREA	72.00
GR. FLOOR	72.00	GR. FLOOR	72.00	GR. FLOOR	72.00	GR. FLOOR	72.00	GR. FLOOR	72.00
1ST FLOOR	48.14	1ST FLOOR	48.14	1ST FLOOR	48.14	1ST FLOOR	48.14	1ST FLOOR	48.14
2ND FLOOR	37.76	2ND FLOOR	37.76	2ND FLOOR	37.76	2ND FLOOR	37.76	2ND FLOOR	37.76
3RD FLOOR	37.76	3RD FLOOR	37.76	3RD FLOOR	37.76	3RD FLOOR	37.76	3RD FLOOR	37.76
4TH FLOOR	37.76	4TH FLOOR	37.76	4TH FLOOR	37.76	4TH FLOOR	37.76	4TH FLOOR	37.76
5TH FLOOR	37.76	5TH FLOOR	37.76	5TH FLOOR	37.76	5TH FLOOR	37.76	5TH FLOOR	37.76
6TH FLOOR	37.76	6TH FLOOR	37.76	6TH FLOOR	37.76	6TH FLOOR	37.76	6TH FLOOR	37.76
7TH FLOOR	37.76	7TH FLOOR	37.76	7TH FLOOR	37.76	7TH FLOOR	37.76	7TH FLOOR	37.76
8TH FLOOR	37.76	8TH FLOOR	37.76	8TH FLOOR	37.76	8TH FLOOR	37.76	8TH FLOOR	37.76
TOTAL	476.28	TOTAL	476.28	TOTAL	476.28	TOTAL	476.28	TOTAL	476.28

[illegible]


2nd. FL.(UNIT AREA CALC.)
SCALE :- 1.00 CM. = 2.00 MT.



2nd. FL. PLAN



1st. FL. PLAN



IR. FL. PLAN

ખાસ સરત !

શરમાલિકી સત્તાપદવની રહેશે. નાં રોજ માલિક સોર્જોનાઈઝ્ડ ટ્રેડિંગ કંપની તથા રૂઝકારણ એન્જનીયરિંગ આયેલ્ડ લિમિટેડ દ્વારા દર્શાવેલ વસ્તુઓનું ચુસ્તપણે કરવાનું રહેશે.

प्राप्त सतत :
विज्ञान पर्यावरणी मंत्रालय ऑफिस भारात १००
सदर: जे ओडिसा प्रीत क्षेत्र (सदर: हरेल) खेले

આંકડા કરશે તારફનું સ્પષ્ટીકરણનાકર ઉપરથી
પારિસ્થિતિકની ચકાસણી કરાવી જે તે ઓગડામાં
વિદ્યમાન પરવાનાઈ મુજબનું છે. તે અલગલગનું પ્રા
પેરનવા ઓગડા આગળના ઓગડાનું ઓગડામાં

ਸ੍ਰੋਤ: ਗੇ-ਅਭਿਟ ਟੋਪਾ ਐਮੀਟ ਟੋਪਾ ਟੋਪਾ ਟੋਪਾ	ਨਿਰਾਗਾ ਟਿਕਟੀ ਟੋਪਾ ਟੋਪਾ ਟੋਪਾ	ਟਿਕਟੀ ਟੋਪਾ ਟੋਪਾ ਟੋਪਾ ਟੋਪਾ	ਟੋਪਾ ਟੋਪਾ ਟੋਪਾ ਟੋਪਾ
ਸਾਧਨ ਟੋਪਾ ਟੋਪਾ	ਟੋਪਾ ਟੋਪਾ ਟੋਪਾ ਟੋਪਾ	ਟੋਪਾ ਟੋਪਾ ਟੋਪਾ ਟੋਪਾ	ਟੋਪਾ ਟੋਪਾ ਟੋਪਾ ਟੋਪਾ
ਟੋਪਾ ਟੋਪਾ ਟੋਪਾ ਟੋਪਾ	ਟੋਪਾ ਟੋਪਾ ਟੋਪਾ ਟੋਪਾ	ਟੋਪਾ ਟੋਪਾ ਟੋਪਾ ਟੋਪਾ	ਟੋਪਾ ਟੋਪਾ ਟੋਪਾ ਟੋਪਾ

१७३२

N. P. PARMAR
AUDA/STR. ENGINEER
REGD. NO. SD-1/065
10, Pathik Society,
Naranpura, Ahmedabad-13.

ST-ENGINEER	EN
-------------	----

The permission is valid only in the DP/TPS remains unaltered and further that the permission shall stand revoked as soon as

there is change in DP/TFS with reference to the land under reference.

[illegible]

Vivek Shukla
Consulting Engineer
AUDA ENG/106S
AUDA COW/754
45, Nikamal Soc., Nr. Tusi Nagar,
Palodi, Ahmedabad,
(Mo.) 9376123707

ER
2018/2018
2018/2018

પર પ્રતિબદ્ધ કરવાના રહેશે

APPROVED
 signed by Rad (Colour) Subject
 condition as mentioned in the
 letter PRM No. 15/272017

3 R 2017 *sd* *Ab* 1 4 5
Note Approved by Chairman
Senior Town Planner

